



સીટી ઓફ બ્રેમ્પટન રહેવાસીઓને અતિશય ગરમી દરમિયાન ઠંડક મેળવવાની સૂચના આપે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 29, 2021) – શીજીયન ઓફ પીલે વાતાવરણ અતિશય ગરમ રહેવાની આજે આપેલી ચેતવણી પછી, સીટી ઓફ બ્રેમ્પટન રહેવાસીઓને ઠંડક રાખવાના મહત્વની યાદ અપાવે છે.

સીટીના સ્પ્લેશ પેડના ક્લાકો સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી છે અને ચિંગકુસી પાર્કનું વેડિંગ પૂલ દરરોજ સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, જો હવામાન અનુકૂળ હોય. પ્રોફ્રેસર્સ લેક બીચ અને અલડોરાડો પાર્કનું આઉટડોર પૂલ આગામી સીઝન માટે આવતી કાલે, જૂન 30 થી ફરી ખુલવા નિર્ધારિત છે, જો હવામાન અને પાણીની સ્થિતિ અનુકૂળ રહે.

સ્પ્લેશ પેડ્સ અને પૂલ્સની મુલાકાત લો ત્યારે, રહેવાસીઓને આરોગ્ય અને સુરક્ષાને સર્વોત્તમ ધ્યાનમાં રાખવાનું કહેવામાં આવે છે. વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર રાખો, અને આ મુશ્કેલ હોય ત્યારે માર્સ્ક પહેરો. સ્પ્લેશ પેડ્સ અને વેડિંગ પૂલ્સની સંપૂર્ણ યાદી માટે વેબસાઇટ જુઓ, www.brampton.ca.

બ્રેમ્પટનવાસીઓ અતિશય ગરમીને હરાવવા નીચેની સૂચના ધ્યાનમાં રાખી શકે છે:

ઘર બહારની (આઉટડોર) પ્રવૃત્તિ નિયંત્રિત કરો

રહેવાસીઓને આઉટડોર પ્રવૃત્તિઓ નિયંત્રિત કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ ભલામણ પણ કરવામાં આવે છે કે જાહેર જનતા સૂર્યના તાપથી દૂર રહે, પાણી પુષ્કળ પીવે અને એર કંડિશનર અથવા છાંયડાવાળી જગ્યાઓએ રહે.

જોખમમાં રહેતી વ્યક્તિઓ

વડીલો અને જુવાન બાળકોને ખાસ કરીને જોખમ રહેતું હોય છે, અને રહેવાસીઓ પોતે પોતાના જે મિત્રો અને કુટુંબીજનો જોખમમાં હોવાનું વિચારતા હોય તેઓની તપાસ વર્ચુઅલી અથવા ફોન પર કરતા રહેવા તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

પાળેલા પ્રાણીઓ

પાળેલા પ્રાણીઓને ઠંડા રાખવામાં મદદરૂપ માહિતી:

- તમારા પાળેલા પ્રાણીઓને ઘરમાં રાખો અને બહારની ગરમીમાં તેઓને ચાલવા લઈ જવાનું ટાળો - જો પગદંડી (ફૂટપાથ) ઉઘાડા પગ માટે બહુ ગરમ હોય તો, તે પ્રાણીઓના નરમ પંજા માટે બહુ ગરમ હોય છે.
- તાજુ પાણી પુષ્કળ માત્રામાં પૂરું પાડો
- ઘરની અંદર હવાની અવરજવર રાખો
- સૂર્યના તાપમાં જવાનો સમય મર્યાદિત રાખો અને છાંયડો પૂરો પાડો

ગરમ ઉષ્ણતામાનમાં, બાળકો કે પાળેલા પ્રાણીઓને વાહનોમાં ક્યારેય એકલા છોડશો નહીં.



પાણીમાં સુરક્ષિત રહો

રહેવાસીઓને પાણીની નજીકમાં પણ સુરક્ષિત રહેવાનું યાદ અપાવવામાં આવે છે:

- જુવાન બાળકોને પાણીની આસપાસ હંમેશા હાથવગા પોતાની પહોંચમાં રાખો
- એકલા ક્યારેય તરશો નહીં
- બેકયાર્ડ પૂલ્સની ચારે બાજુએ જાળી કરીને તેમાં પ્રવેશ પ્રતિબંધિત અને નિયંત્રિત કરો
- પૂલ વિસ્તારમાં કે બીચ પર હો ત્યારે જુવાન બાળકોને લાઈફ જૅકેટ પહેરાવો
- તરવા માટે લાઈફ ગાર્ડનું સુપરવીઝન ધરાવતા બીચ અને પૂલ પસંદ કરો
- વપરાશમાં ન હોય તો વેડિંગ પૂલ્સ અને પાણીની ડોલો ખાલી રાખો
- જો તમારી પાસે પૂલ કે કોટેજ હોય તો, કુટુંબીજનો જીવન બચાવવાની આવડતો શીખ્યા હોવાની ખાતરી કરો

ગરમી સામે સુરક્ષા વિશે વધુ માહિતી મેળવવા આ વેબસાઈટ્સ જુઓ, www.brampton.ca અને www.peelregion.ca

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca